https://archive.org/details/bk1405/page/n0/mode/1up

2010-05-07 -Sachot Javab to Satpanthis (1405)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

...હોલ્ડ કરાય, વિકાસ માટે નાણાં ફાળવાય તે જરૂરી

...ટી. સ્વભંડોળમાંથી જેટીઓ બાંધે

ગાંધીધામ, તા. ૫ : આજે નવી દિલ્હીમાં મળેલી સંસદીય શિપિંગ કમિટીની બેઠકમાં કચ્છના સાંસદ પૂનમબેન જાટે બંદરીય વિકાસ માટે ખાનગી ભાગીદારી તળે ... જમીનમાંથી જેટીઓ ... હોલ્ડ કરાય, ... અર્થે નાણાં ... મહત્ત્વના મુદ્દા ... જી.કે. વાસનની ... તમામ નાના- ...નો, સાંસદોની ... બેઠકમાં સભ્ય તરીકે ઉપસ્થિત સાંસદ શ્રીમતી જાટે કેપીટીમાં કચ્છના સ્થાનિક બેરોજગારોને જ નોકરીમાં રાખવા, અન્યથા વિરોધનો સામનો કરવા સ્પષ્ટ વાત મૂકી હતી.

કચ્છના મહારાવે જેતે સમયે મફતમાં આપેલી જમીનો ઉપર કેપીટીએ કબજો જમાવ્યો છે. આ જમીનો ફ્રિ હોલ્ડ કરી દઈને તેના માલિકોને તેનો કબજો સોંપી દેવો જોઈએ તેવી માગણી સાંસદે રજૂ કરી હતી. કંડલા બંદરે જેટીઓ બાંધવા ટેન્ડરો ખોલ્યા પછી પણ કોઈ પાર્ટી જેટી બાંધવા આગળ ન આવતી હોય તો કેપીટી જાતે જેટી બાંધવાનું કામ ઉપાડી લે. કેપીટી પાસે અબજો રૂપિયાનું ભંડોળ અનામત છે તેવું પણ સાંસદે જણાવ્યું હતું.

શિપિંગ કમિટીની બેઠકમાં કચ્છી સાંસદે અનેક સવાલો ઉઠાવ્યા

દરમ્યાન સાંસદે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક લોકોની સુખાકારી માટે કેપીટી દ્વારા કેટલા કામો થયા તેની માગેલી વિગતો સામે પોર્ટ પ્રશાસને ૨૦ વર્ષનો અહેવાલ મોકલ્યો હતો. સાંસદે તે સામે વાંધો ઉઠાવી પરત મોકલી દીધો હતો. આ અંગે બેઠકમાં મુદ્દો ઉઠાવતાં કેપીટીને નીચા જોણું થયું હતું.

ભારતભરના પ્રત્યેક બંદરો સ્થાનિક વિસ્તારના વિકાસ માટે પોતાના નફાની એક ટકા રકમ ખર્ચે તેવી રજૂઆત કમિટીના મોટાભાગના સદસ્યોએ કરી હતી. કચ્છના સાંસદે સીબીઆઈ દ્વારા કોઈપણ જાતના નક્કર આધાર-પુરાવા વગર કેપીટીમાં થતી દરોડાની કાર્યવાહીથી પ્રશાસન મુશ્કેલીમાં આવે છે. આવી સ્થિતિ અટકાવવા અને જો ખરેખર કોઈ દોષી હોય તો તેની સામે કાર્યવાહી કરવા સાંસદે અપીલ કરી હતી. કેપીટીના જે કર્મચારીઓને હજુ રહેણાક પ્લોટો ફાળવાયા નથી, તેમને પ્લોટ ફાળવવાની રજૂઆત પણ તેમણે કરી હતી. શિપિંગ મંત્રીએ ટૂંક સમયમાં ઉકેલ લાવવા ખાતરી આપી હતી. તેમણે શિપિંગ સચિવને કેપીટીની મુલાકાતનો આદેશ પણ કર્યો હતો. આ બેઠકમાં કેપીટી ચેરમેન પી.ડી. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

મોઢબ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ

દર્શના મહેશચંદ્ર પંડયા
(પ્રાઈમરી શિક્ષીકા, કુકમા)

કચ્છ યુનિવર્સિટીમાં T.Y.B.A. (એક્સટર્નલ)માં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા.

- સ્વ. લાભકુંવરબેન ભવાનીશંકર પંડયા (દાદી-દાદા)
- પ્રજ્ઞાબેન મહેશચંદ્ર પંડયા (માતા-પિતા)
- મનીલા, ચૈતાલી (બહેન)

આપની જરૂરીયાત, અમારી જવાબદારી

ShriHari developers

- પ્લાનીંગ
- ડીઝાઈનીંગ
- એલીવેશન (3D)
- કન્સ્ટ્રકશન
- ઈન્ટીરીયર ડીઝાઈનીંગ

આપના ડ્રીમ હોમનાં નિર્માણની તમામ જરૂરીયાત હવે એક જ સ્થળે..

સંપર્ક : પુલીન પવાણી 98255 90915
કચ્છ મેડીકેર હોસ્પિટલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ. ફોન : 290005

જલસેવા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. ભુજના સર્વે સભાસદોને જાણ કરવામાં આવે છે કે, આપણી મંડળીની વાર્ષિક ખાસ સાધારણ જનરલ સભા તા : ૦૮/૦૫/૨૦૧૦ ના રોજ "બન્ની ઈન્સ્પેકશન બંગલો", સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે, ભુજ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે બોલાવવામાં આવેલ છે. તો દરેક સભાસદે ઉપરોક્ત સ્થળે સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી.

દેવરાજા જન્મ તા. ૧/૦૬/૭૬, સ્વ. તા. ૧૦/૦૭/૨૦૦૨

અખિલ કચ્છ મહેશ્વરી (મેઘવાળ)
ક્રિકેટ ટુર્નામેન્ટ ભુજપર દેવકપ

આથી સર્વે મહેશ્વરી (મેઘવાળ) ભાઈઓને જણાવવાનું કે ભોજારા વાળા મતિયાદેવ મંદિર ભુજપુર ગ્રાઉન્ડ ઉપર સ્વ. દેવરાજ રાણા પાતારિયા સ્મૃતિ કપ નો આયોજન કરેલ છે. તો બધાજ મહેશ્વરી (મેઘવાળ) ક્રિકેટ પ્રેમીઓને ભાગ લેવા નમ્ર વિનંતી

સેન્ટ્રી ફી ભરવાની છેલ્લી તા. ૧૦/૦૫/૨૦૧૦ સેન્ટ્રી ફી રૂા. ૫૫૧/-

સેન્ટ્રી ફી ભરવાનું સ્થળ:- ચામુંડા ઝેરોક્ષ, બસ સ્ટેશન, ભુજપર-કચ્છ

ખાસનોંધ: મહેશ્વરી (મેઘવાળ) ભાઈઓ સિવાય કોઈપણ ભાગ લઈ શકશે નહિં.

કોન્ટેક નંબર:-
- જીતેન્દ્ર માલશી વંજારા: ૯૯૭૯૧ ૭૦૯૨૧
- રમેશ તેજા પાતારીયા: ૯૭૨૭૧ ૯૯૯૦૪
- ધનજી જુમા પાતારીયા: ૯૦૯૯૪ ૮૧૫૪૧
- ચેતન દેવશી વંજારા: ૯૯૦૯૫ ૬૪૭૬૨
- ધનજી રાણા પાતારિયા: ૯૭૧૨૮ ૬૫૯૬૩

ૐ સાંઈ રામ

મુન્દ્રા ઓફિસનો
ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ
મે. હસ્તિન્ આચાર્ય એન્ડ કું.
(ટેક્ષ એડવોકેટ)
૩, મૈત્રી કોમ્પલેક્ષ, બસ સ્ટેશન પાસે, બારોઈ રોડ, મુન્દ્રા કચ્છ. મો: ૯૦૩૩૪ ૯૬૫૪૬
સર્વે ક્લાઈન્ટ્સ મિત્રોનો હાર્દિક આભાર
હેડ ઓફિસ - ભુજ : ૨૦૬, ૨૦૭, સ્વામિનારાયણ કોમ્પલેક્ષ, બેંક ઓફ ઈન્ડિયા- દિવ્ય ભાસ્કરની ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ.
ટેલિ-ફેક્સ (૦૨૮૩૨) ૨૨૦૬૭૧, ૯૮૭૯૫ ૩૦૬૭૧
હસ્તિન્ભાઈ આચાર્ય - મો : ૯૮૨૫૨ ૩૦૬૭૧

Congratulation

Raksha (Rinku) A. Jadeja
T.Y. B.A (English)
4th Rank in Kutch University

Chhaya B. Sodha
T.Y. B.A (English)
5th Rank in Kutch University

Best wishes on your success with flying colours....

★ Dimple Goswami ★ Farook Sama ★ Dhairya Gor
★ Ankita Sodha ★ Bhumit Gadhavi ★ And Friends..

પંજાબ નેશનલ બેંકને મકાન ભાડે જોઈએ છે

પંજાબ નેશનલ બેંકને તેની ભુજ શાખા માટે સ્ટેશન રોડ/હોસ્પિટલ રોડ પર આશરે ૧૩૦૦ થી ૧૮૦૦ સ્કવેર ફીટ કાર્પેટ એરીયા વાળું ગ્રાઉન્ડ અથવા ફર્સ્ટ ફ્લોર પર મકાન ભાડે જોઈએ છે.

રસ ધરાવતા ઈસમોએ તેઓના ટેક્નીકલ બીડ અને પ્રાઈઝ બીડના નિર્ધારિત ફોર્મ પંજાબ નેશનલ બેંક, ભુજ શાખા ખાતેથી મેળવી તેને ટેક્નીકલ બીડ અને પ્રાઇઝ બીડ એમ બે અલગ-અલગ સીલબંધ પરબિડિયામાં ૧૦ દિવસની સમય મર્યાદામાં મોકલી આપવાના રહેશે.

આ માટેનું નિર્ધારિત ફોર્મ પીએનબી, ભુજ શાખાના નામનો રૂપિયા ૨૫૦/-નો નોન-રિફન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટથી મેળવી શકે છે.

ટેક્નીકલ બીડમાં મકાનનું સ્થળ, ફ્લોર, બાંધકામનો પ્રકાર, કંસ્ટ્રકશનનો પ્રકાર, સુવિધાઓ, મંજુર થયેલ પ્લાન, કોમર્શીયલ યુઝ સર્ટિફિકેટ, ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ, પાર્કિંગ સુવિધા અને જગ્યાને લાગતા અન્ય દસ્તાવેજોની નકલો બીડવી.

પ્રાઈઝ બીડમાં પ્રતિ સ્કવેર ફીટ મકાનનું માસિક ભાડું, સોસાયટી/કોમ્પ્લેક્ષનો મેઈન્ટેનન્સ ચાર્જ, નગરપાલિકા /સરકારી કરવેરા અને પઝેશનની વિગતો મોકલી આપવી.

બેંક મેનેજમેન્ટ કોઈપણ કારણ જણાવ્યા વગર કોઈપણ કે બધાજ પ્રસ્તાવોને સ્વીકારવાનો કે અસ્વીકારવાનો તેનો અધિકાર સુરક્ષિત રાખે છે.

અરજી મોકલવાની છેલ્લી તારીખ ૧૫/૦૫/૨૦૧૦

દલાલોએ તસ્દી લેવી નહીં.



જાહેર આમંત્રણ

શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

કથા પ્રારંભ
સંવત ૨૦૬૬
અધિક વૈશાખ વદ-૮
તા. ૦૬/૦૫/૨૦૧૦, ગુરુવાર

કથા વિરામ
સંવત ૨૦૬૬
અધિક વૈશાખ વદ અમાસ
તા. ૧૪/૦૫/૨૦૧૦, શુક્રવાર

વક્તા: શ્રી હિરેનભાઈ પંચાલ (ગાંધીધામ)

કથા સમય
સવારે ૯.૦૦ થી ૧૨.૦૦, સાંજે ૪.૦૦ થી ૭.૦૦

શ્રી દશરથભાઈ પ્રેમજીભાઈ ઠક્કર પરીવાર
પરમ પૂજ્ય શ્રી હરીદાસજી મહારાજ

નિમંત્રક : શ્રી આઈ આશાપુરા સેવા ટ્રસ્ટ

શુભ કથા સ્થળ : આઈશ્રી આશાપુરા ધામ, ગરબી ચોક, ભારતનગર, ગાંધીધામ (કચ્છ)

સતપંથીઓના ભ્રામક પ્રચારથી ચેતો...

નિષ્કલંકી નારાયણની સાચી ઓળખ

ઈરાનથી ભારત દેશમાં આવેલા પીર સદરુદ્દીનના પૌત્ર ઈમામુદ્દીનને (ઈમામશાહ) પોતાના દાદા દ્વારા સ્થાપિત 'સતપંથ'નો ફેલાવો વધારવાનો નિર્ધાર કર્યો અને હિન્દુઓને વટલાવવા માટે હિન્દુઓના ધાર્મિક શાસ્ત્રો જેવા કે વેદ, ઉપનિષદો, પુરાણો વગેરેનો ગહન અભ્યાસ કર્યા બાદ આવા શાસ્ત્રો અને પવિત્ર પુસ્તકોનું પોતાની રીતે ઈસ્લામીકરણ કર્યું. આવી રીતે ઈસ્લામીકરણની પ્રક્રિયામાં ઈમામ શાહે હિન્દુઓ દ્વારા જે ભગવાન વિષ્ણુના 'દશાવતાર'ને માન્યતા આપેલ છે તે તમામ અવતારો પોતાની ઈસ્લામી શૈલીમાં ફરીથી લખ્યા અને આ અવતારોનું પણ ઈસ્લામીકરણ કર્યું. તે પૈકીના છેલ્લા અવતાર 'કલંકી'નું પણ ઈસ્લામીકરણ કરી નકલંકી નારાયણ (વિષ્ણુ) એવું કાલ્પનિક નામ ફક્ત સતપંથીઓના લાભાર્થે અને હિન્દુઓને ગેરમાર્ગે દોરવાના હેતુસર પ્રચલિત કર્યું.

ઈમામશાહે નકલંક નારાયણનો જન્મ થઈ ગયો છે એમ કહ્યું છે અને તે યોગ્ય સમયે પ્રજાજનો સમક્ષ આવશે તેવું જણાવ્યું છે. આ નકલંકીની ઓળખ આપતી વખતે ઈમામશાહ બાવાએ જણાવ્યું છે કે આ નિષ્કલંકી નારાયણ બીજું કોઈ નથી પરંતુ ઈસ્લામના સ્થાપક હઝરત મહમ્મદ પૈગમ્બરના જમાઈ હઝરત અલી એ જ નિષ્કલંકી નારાયણ છે. હિન્દુઓની આદ્યશક્તિ જે જુદા જુદા નામે - જેવા કે દુર્ગા, ભવાની, કાલિકા, ઉમા, અંબિકા, ભવાની વગેરે તે બીજું કોઈ નથી પરંતુ નિષ્કલંકી નારાયણ (હઝરત અલી)ની પત્ની બીબી ફાતિમા છે.

www.ismaili.net/source/0723/07231e.htmlને આધારે

મોટે દશા અવતાર : રચનાર સઈયદ ઈમામશાહ (ગુજરાતીમાં) પ્રગટ કરનાર મુખી લાલજીભાઈ દેવરાજ—સંવત ૧૯૮૦ સને ૧૯૨૩ના આધારે.

॥ શ્રી સનાતન ધર્માય નમઃ ॥

- સત્યનો પ્રકાશ -

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જ્યારે તેનો સ્વર્ણિમ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર પ્રજાજનોને જાણ થાય તે હેતુસર નીચે મુજબની માહિતીઓ આપવી છે. આ માહિતીઓ કોઈ વ્યક્તિ કે સમાજ તરફથી બનાવવામાં આવી નથી. આજના કોમ્પ્યુટર તેમજ ઇન્ટરનેટના યુગમાં અમેરિકાની વિશ્વ માન્ય સંસ્થા wikipedia.org તેમજ gujaratilexicon.com દ્વારા સમગ્ર દુનિયામાં પ્રસારિત કરવામાં આવેલ છે.

I. www.gujatilexicon.com પ્રમાણે

૧. 'સતપંથી' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.

અ. ખોજા મુસલમાનોના પંથનું કે તેને લાગતું.

બ. જે કણબીઓ ગુજરાત, કચ્છ અને ખાનદેશમાં ફેલાયા તેઓને આશરે ૫૦૦ વર્ષ પહેલાં સૈયદ ઈમામશાહ નામના ઈસ્લામ પરિ શિયા મુસલમાન બનાવ્યા એવું કહેવાય છે, અમદાવાદ, નવસારી અને બર્હાનપુરની મુસલમાની પીરોની અને અર્ધા મુસલમાન જેવા છે તેઓ રોજા (ચંદ્ર) રાખે છે અને દિવાળી-હોળી વગેરે પાળે છે.

૨. 'મુમના' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :

કણબીની એક જાત જે પીરાણા પંથમાં મુસલમાન ધર્મમાં ગયેલા હિન્દુઓની એક જાતિ પીરાણાની સૈયદ ઈમામશાહએ હિન્દુ ધર્મના માણસોને મુસલમાન બનાવ્યા તે જ્ઞાતિ. એ લોકો રીત-રિવાજમાં અર્ધા હિન્દુ અને અર્ધા મુસલમાન માફક રહે છે.

૩. 'ઈમામશાહ' કોણ હતા :

અ. ઈ. સ. ૧૪૯૯માં ઈરાનથી ગુજરાતમાં આવેલા પીરાણા પંથના સ્થાપક.

બ. પીરાણા અગર કાકા પંથના સ્થાપક એ નામના મુસલમાની સૈદ તે ખોજાની પીર સદરૂદ્દીનના પૌત્ર હતા. તે અમદાવાદના બાદશાહ મહમદશાહની દીકરીને પરણ્યા હતા.

II. www.wikipedia.org પ્રમાણે

'સતપંથ' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.

Satpanth is a subgroup of Nizari Ismailism and Ismaili Sufism formed by conversions from Hinduism 700 years ago by Pir Sadruddin (1290-1367) and 600 years ago in the 15th century by his grandson Pir Imam Shah (1430-1520).

There are villages in Gujarat which are totally 'Satpanthi' such as Pirana near Ahmedabad where Imam Shah is buried.

જાહેર જનતા ગેરમાર્ગે ન દોરાય તે અર્થે પ્રસિદ્ધ કર્તા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ

॥ શ્રી સનાતન ધર્માય નમઃ ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, પીરાણા દ્વારા તા. ૧/૫/૨૦૧૦ના શ્વેતપત્ર બાબતે અપાયેલ જાહેરાતનો

સચોટ જવાબ

૧. **કચ્છ કડવા પાટીદાર સમાજનું વિભાજન :** સમાજનું વિભાજન શ્વેતપત્ર દ્વારા નથી થતું. સમાજનું વિભાજન તો ત્યારે જ થઈ ગયું હતું કે અમારી કેન્દ્રીય સમાજના સ્થાપક વડીલોએ પીરાણા સતપંથ મતનો સદંતર ત્યાગ કરી આપણો મૂળ સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કરીને આ સમાજની સ્થાપના કરી હતી.

૨. **નાના-મોટા સાંપ્રદાયિક ભેદભાવ :** શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં સાંપ્રદાયિક ભેદભાવ કે વિવાદો છે જ નહીં. વિવાદો જે કોઈ સર્જાય છે તે સનાતન હિંદુ ધર્મ અને મુસ્લિમ પીર સૈયદ ઈમામશાહ બાવા પ્રેરિત સતપંથ ધર્મ વચ્ચે સર્જાયા છે, જે પીરાણા સતપંથ મતને લઈને જ્ઞાતિની ઓળખાણ મુમના મુસલમાન તરીકે થતી હતી. તેથી આપણા સમાજ સુધારક વડીલોએ તે પીરાણા સતપંથ મતનો સદાયને માટે ત્યાગ કરી જ્ઞાતિના મૂળ સનાતન હિંદુ ધર્મને જ્ઞાતિમાં પ્રસ્તાપિત કરવા માટે થઈને શ્રી અ.ભા.ક.ક. પાટીદાર સમાજની સ્થાપના કરી હતી તેથી આ સમાજ સનાતની સમાજ છે. બાકી પીરાણા સતપંથ ધર્મીઓની તો તેમની પોતાની વરસો જૂની સતપંથ સમાજ છે. છતાં પણ આ સમાજમાં રહીને સનાતની પ્રવાહમાં એકરસ થયા વગર નાહકના ધાર્મિક વિવાદો સર્જી રહ્યા છે અને તેને સાંપ્રદાયિક વિવાદો છે તેમ બતાવી સમગ્ર હિંદુ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

૩. **કેન્દ્રીય સમાજની સમાધાન સમિતિ :** આ સમિતિનું ગઠન એટલા માટે જ થયેલ કે સતપંથી ભાઈઓ દ્વારા છાસવારે કરવામાં આવતા કોર્ટ કેસો તેમજ ખોટી પોલીસ ફરિયાદો ત્વરિત પાછી ખેંચી લેવામાં આવે. પણ આનાથી વિપરીત જઈ પીરાણા સતપંથી ભાઈઓએ આવી સમાધાનની મિટિંગ વખતે જ તા. ૨૭/૨/૨૦૧૦ના દિવસે અમદાવાદથી પોલીસ તેડાવી સનાતની મુરબ્બી શ્રી રમેશભાઈ માવજી વાગડિયાની કેન્દ્રીય સમાજના સંકુલમાંથી ધરપકડ કરાવી. સમાધાન સમિતિની ઈજ્જત રગદોળી નાખીને પીઠ પાછળ ઘા કર્યો કારણ કે પીરાણા સતપંથ ધર્મીઓની સંપૂર્ણ આસ્થા તેની સતપંથ સમાજમાં જ છે એવું હવે નિર્વિવાદ રીતે પુરવાર થાય છે કારણ કે સનાતની સમાજનો કોઈપણ સભ્ય પોતાની સમાજના મુખ્ય કાર્યાલય ઉપર આવી કલંકરૂપી કાર્યવાહી કરે નહીં.

૪. **ધનસુરાના ઠરાવો :** ધનસુરા મુકામે જે કોઈ ઠરાવો થયા તે સનાતની ભાઈઓના આંતરિક અને અંદરુની ઠરાવો હતા તેને સતપંથ સમાજ કે સતપંથ ધર્મીઓ સાથે કાંઈજ લેવા દેવા નથી.

૫. **કેન્દ્રીય સમાજના બંધારણનું વાસ્તવિક અર્થઘટન :** કેન્દ્રીય સમાજના બંધારણનું વાસ્તવિક અર્થઘટન શું છે તે ઈરાનથી આવેલા સૈયદ પીર ઈમામ શાહ બાવા પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ પાળતા ભાઈઓને શું ખબર પડે ? કારણ કે આ સમાજની સ્થાપના એવા સુધારક વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેમને એમ લાગેલું કે પીરાણા સતપંથ મત આપણી કડવા પાટીદાર જ્ઞાતિને લાયક મત નથી. એથી જ આ વડીલોએ તે સતપંથ મતનો હંમેશના માટે ત્યાગ કર્યો હતો પણ દુઃખની વાત એ છે કે આવા વડીલોની વાતને ધ્યાનમાં લીધા વગર જ્ઞાતિનો અમુક વર્ગ આજ દિવસ સુધી પીરાણા સતપંથ મતને વળગી રહ્યો. તે વર્ગ આ કેન્દ્રીય સમાજને આજ દિવસ સુધી વફાદાર રહ્યો નથી અને ફક્ત તેમના અહં પોસવા ખાતર અને જીદ્દી વલણને લઈને ન કેવળ સનાતની હિન્દુ કચ્છ કડવા પાટીદારોને પરંતુ સમગ્ર હિન્દુ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેથી સમગ્ર હિન્દુ પ્રજાએ ચેતવા જેવું છે. રમેશભાઈ માવજી વાગડિયા કેન્દ્રીય સમાજના બંધારણના વાસ્તવિક અર્થઘટનથી નારાજ નથી પણ બહુ જ ખુશ છે. કારણ કે બંધારણનું વાસ્તવિક અર્થઘટન ઉપર મુજબનું છે.

૬. **સતપંથ સમાજની લાગણીઓ દુભાય એવા પ્રયત્નો :** આપણી કેન્દ્રીય સમાજ ૫૦ વરસ પૂરા કરી અત્યારે સ્વર્ણિમ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે જ્ઞાતિનો ઈતિહાસ તેમજ સમાજનો સાચો ઈતિહાસ જ્ઞાતિ સમક્ષ મૂકવો તે કાંઈ ગૂનો ન કહેવાય. આપણી જ્ઞાતિનો ઈતિહાસ ગૌરવશાળી ન હોય અને તે અમુક વર્ગના માણસો પસંદ ન કરતા હોય તેથી શું ઈતિહાસ બદલાવી નાખવો ? ૨૦૦૫માં રમેશભાઈ માવજી વાગડિયાએ જ્ઞાતિના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડેલ તેથી શું ખોટા કોર્ટ કેસો ઊભા કરવા અને ખુલ્લે આમ જ્ઞાતિ રીત રિવાજોની કલમ ૧૯નો ભંગ કરવો ? આવા કામો સતપંથી ભાઈઓ આદ્ય સુધારક નારાયણજી બાપાના વખતથી આજ દિવસ સુધી કરતા આવ્યા છે.

૭. **કેન્દ્રીય સમાજનું શ્વેતપત્ર અને વાસ્તવિકતા :** વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સમાજે શ્વેતપત્ર બહાર પાડ્યું તે સનાતન સમાજના દબાણ હેઠળ બહાર પડ્યું તેમ કહેવું એ હાસ્યાસ્પદ બાબત છે કારણ કે સનાતન સમાજ એ કઈ સમાજ છે ? ભલા માણસ કેન્દ્રીય સમાજ જે એક સનાતની ઓળખ ધરાવતી સમાજ છે તેને અન્ય સમાજોના દબાણની જરૂરત રહેતી નથી. વધારેમાં શ્વેતપત્ર બહાર પાડવું તે કેન્દ્રીય સમાજનો પોતાનો અંગત મામલો છે. તેને અન્ય સમાજોની ભલામણની જરૂરત રહેતી નથી. બંધારણમાં સુધારા વધારા કરવા તે પણ કેન્દ્રીય સમાજનો અબાધિત અધિકાર છે તેમાં વિધર્મીઓની સમાજોએ દખલગીરી ન કરવી હિતવાહક હશે.

૮. **બેરીસ્ટર શ્રી વીરેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ બંધારણ :** કોઈપણ સમાજનું બંધારણ ધાર્મિક વિચારધારા વગર બનાવવામાં આવતું નથી. ધર્મ અને સમાજ એકજ સિક્કાની બંને બાજુઓ છે. ધર્મ અને સમાજ કોઈ દિવસ જુદા હોઈ જ ન શકે. વિશ્વ માન્ય gujaratilexicon.com દ્વારા બહાર પાડવામાં આવેલ સમાજ શબ્દની સાચી વ્યાખ્યા પ્રમાણે ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે સમાજ એને જ કહેવાય કે જ્યાં વ્યવસ્થિત લોકોનો જન સમુદાય.
૧) એક જ ધર્મ પાળતો હોય
૨) એક જ રીત રિવાજ પાળતો હોય અને
૩) એકજ આચાર વિચારને વરેલો હોય.
તે પ્રમાણે આપણી કેન્દ્રીય સમાજ એક જ ધર્મ સનાતન હિન્દુ ધર્મ પાળે છે. એકજ રીતિ રિવાજ પાળે છે. અને તે એક જ આચાર વિચારને વરેલો છે. તેથી તેમાં વિધર્મીઓને સ્થાન જ હોઈ ન શકે.

૯. **સમાજના સ્થાપક ટ્રસ્ટીઓ :** આ સમાજની રચના પહેલાં આપણે સૌ જ્ઞાતિજનો ઈરાનથી આવેલા મુસ્લિમ સૈયદ ઈમામશાહ બાવા પ્રેરિત પીરાણા સતપંથ મતમાં ભટકાયેલા હતા તેથી તેઓ સૌ સતપંથી હતા. તેથી એમ કહેવું કે આ સમાજની સ્થાપના સતપંથીઓ એ કરી છે તે એક ભૂલ ભરેલી ભ્રામક વાત છે. મૂળ હકીકત તો ઉપર ફકરા ૧ અને ૨ માં આપ્યા પ્રમાણે આ સમાજની સ્થાપના એક સનાતની સમાજ તરીકેની થઈ છે તેમાં બેમત નથી.

૧૦. **બંધારણના નિયમ ૧થી ૧૭ તથા ૧૮ અને ૧૯ :** સતપંથીઓ એવું ઘટન કરે તે શું આખરી ? અરે પહેલાં વાતને સમજો અને પછી લખો તો સારું. રીતિ રિવાજોના નિયમ ૧થી ૧૭ સામાજિક છે પણ કલમ નંબર ૧૮ અને ૧૯ ધર્મને લગતી કલમો છે તેમાં ભલા માણસ કોઈજ બાંધ છોડ ન થઈ શકે. એટલે એ ફરજિયાત બને છે. સભ્યના બાહ્ય આચરણો જન્મથી મરણોતર સુધી હિન્દુના હોવા જોઈએ તે જ દર્શાવે છે કે આ સમાજ સનાતન હિન્દુ ધર્મીઓની સમાજ છે અને તેનો સભ્ય ફક્ત સનાતન હિન્દુ ધર્મ પાળતો હોવો જોઈએ અને તેથી જ આ સમાજમાં વિધર્મીઓને કોઈ દિવસ સ્થાન આપી શકાય જ નહીં.

૧૧. **મુસ્લિમ સૈયદ ઈમામ શાહ બાવા પીરાણા સતપંથ એ સનાતન હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી.** એ એક ઈસ્લામના પેટામાં આવતો શિયાધર્મનો એક ફાંટો છે. તેવી વિશ્વ માન્ય ઈન્ટરનેટ www.wikipedia.org દ્વારા વ્યાખ્યા અપાયેલ છે. હિન્દુ પ્રજાને વધારે આ બાબતે જાણવું હોય તો તે ઈન્ટરનેટની સાઈટમાં જઈને જાણી શકે છે.

૧૨. **સમાજને જોડવાનું અને તોડવાનું મિશન :** આપણી કેન્દ્રીય સમાજ એક સનાતની ઓળખ ધરાવતી સમાજ છે અને તે દરેક સનાતનીઓને જોડવાનું કામ કરે છે. સતપંથ સમાજ તો એક પ્રતિસ્પર્ધી સમાજ છે. તેના સભ્યો સતપંથ ધર્મ પાળતા હોવાથી કેન્દ્રીય સમાજને કોઈ દિવસ વફાદાર રહ્યા નથી અને ભવિષ્યમાં રહીજ નહીં શકે. હવે ઘણું થયું સતપંથીઓની શ્રદ્ધા પીરાણા સતપંથ ધર્મમાં હોય તો તેઓને નમસ્કાર છે અને તેઓ ત્યાંજ રહી તેમની શ્રદ્ધા અને વફાદારી કાયમ રાખે અને સનાતની ઓળખ ધરાવતી આ કેન્દ્રીય સમાજમાં દખલગીરી કરવાનું બંધ કરે. હવે પછી તેઓને રહેવું હોય તો સમાજના સનાતની પ્રવાહમાં ભળી જઈ સમાજે બહાર પાડેલ શ્વેતપત્રને માન આપી સમાજમાં રહેવું યોગ્ય ગણાશે.

૧૩. **કેન્દ્રીય સમાજમાં બહુમતી કે લઘુમતી એવો પ્રશ્ન જ નથી :** ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વાત પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ એક સનાતન ધર્મીઓની સમાજ છે અને તે ફક્ત અને ફક્ત સનાતન ધર્મીઓના હિતોની રક્ષા કરવા માટે જ બનાવવામાં આવેલ એક સમાજ છે. તેથી તે સમાજમાં ફક્ત સનાતન હિન્દુ ધર્મીઓજ રહી શકે અને વિધર્મીઓનું આ સમાજમાં સ્થાન ન જ હોય.

૧૪. **સ્વર્ણિમ મહોત્સવ :** સ્વર્ણિમ મહોત્સવ પહેલા કેન્દ્રીય સમાજની અસાધારણ સામાન્ય સભા તા. ૭-૫-૨૦૧૦ના દિવસે રાખવામાં આવેલ છે તેથી તા. ૭-૫-૨૦૧૦થી તા. ૧૨-૫-૨૦૧૦ દરમ્યાન દરેક સનાતની ભાઈઓ તન-મન-ધનથી ભાગ લે એવી સૌ સનાતનીઓને નમ્ર વિનંતી.

અ.ભા.ક.ક. પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિ

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1405/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1405/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.23 14:54:51 +05'30'

2010-05-07 -Sachot Javab to Satpanthis (1405)

જમીનો ફ્રિ હોલ્ડ કરાય, વિકાસ માટે નાણાં ફાળવાય તે જરૂરી

કે.પી.ટી. સ્વભંડોળમાંથી જેટીઓ બાંધે

શિપિંગ કમિટીની બેઠકમાં કચ્છી સાંસદે અનેક સવાલો ઉઠાવ્યા

ગાંધીધામ, તા. ૫ : આજે નવી દિલ્હીમાં મળેલી સંસદીય શિપિંગ કમિટીની બેઠકમાં કચ્છના સાંસદ પૂનમબેન જાટે બંદરીય વિકાસ માટે ખાનગી ભાગીદારી તળે કોઈ પાર્ટી તૈયાર ન થાય તો કે.પી.ટી. સ્વભંડોળમાંથી જેટીઓ બાંધે, જમીનો ફ્રિ હોલ્ડ કરાય, સામાજિક વિકાસ અર્થે નાણાં ... કોઈ પાર્ટી જેટી બાંધવા આગળ ન આવતી હોય તો કેપીટી જાતે જેટી બાંધવાનું કામ ઉપાડી લે. કેપીટી કોઈપણ જાતના નક્કર આધાર-પુરાવા વગર કેપીટીમાં થતી દરોડાની કાર્યવાહીથી પ્રશાસન મુશ્કેલીમાં આવે છે. આવી સ્થિતિ અટકાવવા અને જો ખરેખર કોઈ દોષી હોય તો તેની સામે કાર્યવાહી કરવા સાંસદે અપીલ કરી હતી. કેપીટીના જે કર્મચારીઓને હજુ રહેણાક પ્લોટો ફાળવાયા નથી, તેમને પ્લોટ ...

મોઢબ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ

દર્શના મહેશચંદ્ર પંડ્યા (પ્રાઈમરી શિક્ષીકા, કુકમા)

કચ્છ યુનિવર્સિટીમાં T.Y.B.A. (એક્સટર્નલ)માં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર ...

॥ શ્રી સનાતન ધર્માય નમઃ ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, પીરાણા દ્વારા તા. ૧/૫/૨૦૧૦ના શ્વેતપત્ર બાબતે અપાયેલ જાહેરાતનો

સચોટ જવાબ

૧. **કચ્છ કડવા પાટીદાર સમાજનું વિભાજન :** સમાજનું વિભાજન શ્વેતપત્ર દ્વારા નથી થતું. સમાજનું વિભાજન તો ત્યારે જ થઇ ગયું હતું કે અમારી કેન્દ્રીય સમાજના સ્થાપક વડીલોએ પીરાણા સતપંથ મતનો સદંતર ત્યાગ કરી આપણો મૂળ સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કરીને આ સમાજની સ્થાપના કરી હતી.

૨. **નાના-મોટા સાંપ્રદાયિક ભેદભાવ :** શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં સાંપ્રદાયિક ભેદભાવ કે વિવાદો છે જ નહીં. વિવાદો જે કોઇ સર્જાય છે તે સનાતન હિંદુ ધર્મ અને મુસ્લિમ પીર સૈયદ ઇમામશાહ બાવા પ્રેરિત સતપંથ ધર્મ વચ્ચે સર્જાયા છે, જે પીરાણા સતપંથ મતને લઇને જ્ઞાતિની ઓળખાણ મુમના મુસલમાન તરીકે થતી હતી. તેથી આપણા સમાજ સુધારક વડીલોએ તે પીરાણા સતપંથ મતનો સદાયને માટે ત્યાગ કરી જ્ઞાતિના મૂળ સનાતન હિંદુ ધર્મને જ્ઞાતિમાં પ્રસ્તાપિત કરવા માટે થઇને શ્રી અ.ભા.ક.ક. પાટીદાર સમાજની સ્થાપના કરી હતી તેથી આ સમાજ સનાતની સમાજ છે. બાકી પીરાણા સતપંથ ધર્મીઓની તો તેમની પોતાની વરસો જૂની સતપંથ સમાજ છે. છતાં પણ આ સમાજમાં રહીને સનાતની પ્રવાહમાં એકરસ થયા વગર નાહકના ધાર્મિક વિવાદો સર્જી રહ્યા છે અને તેને સાંપ્રદાયિક વિવાદો છે તેમ બતાવી સમગ્ર હિંદુ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

૩. **કેન્દ્રીય સમાજની સમાધાન સમિતિ :** આ સમિતિનું ગઠન એટલા માટે જ થયેલ કે સતપંથી ભાઇઓ દ્વારા છાસવારે કરવામાં આવતા કોર્ટ કેસો તેમજ ખોટી પોલીસ ફરિયાદો ત્વરિત પાછી ખેંચી લેવામાં આવે. પણ આનાથી વિપરીત જઇ પીરાણા સતપંથી ભાઇઓએ આવી સમાધાનની મિટિંગ વખતે જ તા. ૨૭/૨/૨૦૧૦ના દિવસે અમદાવાદથી પોલીસ તેડાવી સનાતની મુરબ્બી શ્રી રમેશભાઇ માવજી વાગડિયાની કેન્દ્રીય સમાજના સંકુલમાંથી ધરપકડ કરાવી. સમાધાન સમિતિની ઇજ્જત રગદોળી નાખીને પીઠ પાછળ ઘા કર્યો કારણ કે પીરાણા સતપંથ ધર્મીઓની સંપૂર્ણ આસ્થા તેની સતપંથ સમાજમાં જ છે એવું હવે નિર્વિવાદ રીતે પુરવાર થાય છે કારણ કે સનાતની સમાજનો કોઇપણ સભ્ય પોતાની સમાજના મુખ્ય કાર્યાલય ઉપર આવી કલંકરૂપી કાર્યવાહી કરે નહીં.

૪. **ધનસુરાના ઠરાવો :** ધનસુરા મુકામે જે કોઇ ઠરાવો થયા તે સનાતની ભાઇઓના આંતરિક અને અંદરુની ઠરાવો હતા તેને સતપંથ સમાજ કે સતપંથ ધર્મીઓ સાથે કાંઇજ લેવા દેવા નથી.

૫. **કેન્દ્રીય સમાજના બંધારણનું વાસ્તવિક અર્થઘટન :** કેન્દ્રીય સમાજના બંધારણનું વાસ્તવિક અર્થઘટન શું છે તે ઇરાનથી આવેલા સૈયદ પીર ઇમામ શાહ બાવા પ્રેરિત પીરાણા સતપંથ ધર્મ પાળતા ભાઇઓને શું ખબર પડે ? કારણ કે આ સમાજની સ્થાપના એવા સુધારક વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેમને એમ લાગેલું કે પીરાણા સતપંથ મત આપણી કડવા પાટીદાર જ્ઞાતિને લાયક મત નથી. એથી જ આ વડીલોએ તે સતપંથ મતનો હંમેશના માટે ત્યાગ કર્યો હતો પણ દુઃખની વાત એ છે કે આવા વડીલોની વાતને ધ્યાનમાં લીધા વગર જ્ઞાતિનો અમુક વર્ગ આજ દિવસ સુધી પીરાણા સતપંથ મતને વળગી રહ્યો. તે વર્ગ આ કેન્દ્રીય સમાજને આજ દિવસ સુધી વફાદાર રહ્યો નથી અને ફક્ત તેમના અહં પોસવા ખાતર અને જીદ્દી વલણને લઇને ન કેવળ સનાતની હિન્દુ કચ્છ કડવા પાટીદારોને પરંતુ સમગ્ર હિન્દુ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેથી સમગ્ર હિન્દુ પ્રજાએ ચેતવા જેવું છે. રમેશભાઇ માવજી વાગડિયા કેન્દ્રીય સમાજના બંધારણના વાસ્તવિક અર્થઘટનથી નારાજ નથી પણ બહુ જ ખુશ છે. કારણ કે બંધારણનું વાસ્તવિક અર્થઘટન ઉપર મુજબનું છે.

૬. **સતપંથ સમાજની લાગણીઓ દુભાય એવા પ્રયત્નો :** આપણી કેન્દ્રીય સમાજ ૫૦ વરસ પૂરા કરી અત્યારે સ્વર્ણિમ મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે ત્યારે જ્ઞાતિનો ઇતિહાસ તેમજ સમાજનો સાચો ઇતિહાસ જ્ઞાતિ સમક્ષ મૂકવો તે કાંઇ ગૂનો ન કહેવાય. આપણી જ્ઞાતિનો ઇતિહાસ ગૌરવશાળી ન હોય અને તે અમુક વર્ગના માણસો પસંદ ન કરતા હોય તેથી શું ઇતિહાસ બદલાવી નાખવો ? ૨૦૦૫માં રમેશભાઇ માવજી વાગડિયાએ જ્ઞાતિના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડેલ તેથી શું ખોટા કોર્ટ કેસો ઊભા કરવા અને ખુલ્લે આમ જ્ઞાતિ રીત રિવાજોની કલમ ૧૯નો ભંગ કરવો ? આવા કામો સતપંથી ભાઇઓ આદ્ય સુધારક નારાયણજી બાપાના વખતથી આંજ દિવસ સુધી કરતા આવ્યા છે.

૭. **કેન્દ્રીય સમાજનું શ્વેતપત્ર અને વાસ્તવિકતા :** વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સમાજે શ્વેતપત્ર બહાર પાડ્યું તે સનાતન સમાજના દબાણ હેઠળ બહાર પડ્યું તેમ કહેવું એ હાસ્યાસ્પદ બાબત છે કારણ કે સનાતન સમાજ એ કઇ સમાજ છે ? ભલા માણસ કેન્દ્રીય સમાજ જે એક સનાતની ઓળખ ધરાવતી સમાજ છે તેને અન્ય સમાજોના દબાણની જરૂરત રહેતી નથી. વધારેમાં શ્વેતપત્ર બહાર પાડવું તે કેન્દ્રીય સમાજનો પોતાનો અંગત મામલો છે. તેને અન્ય સમાજોની ભલામણની જરૂરત રહેતી નથી. બંધારણમાં સુધારા વધારા કરવા તે પણ કેન્દ્રીય સમાજનો અબાધિત અધિકાર છે તેમાં વિધર્મીઓની સમાજોએ દખલગીરી ન કરવી હિતવાહક હશે.

૮. **બેરીસ્ટર શ્રી વીરેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ બંધારણ :** કોઇપણ સમાજનું બંધારણ ધાર્મિક વિચારધારા વગર બનાવવામાં આવતું નથી. ધર્મ અને સમાજ એકજ સિક્કાની બંને બાજુઓ છે. ધર્મ અને સમાજ કોઇ દિવસ જુદા હોઇ જ ન શકે. વિશ્વ માન્ય gujaratilexicon.com દ્વારા બહાર પાડવામાં આવેલ સમાજ શબ્દની સાચી વ્યાખ્યા પ્રમાણે ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે સમાજ એને જ કહેવાય કે જ્યાં વ્યવસ્થિત લોકોનો જન સમુદાય.
૧) એક જ ધર્મ પાળતો હોય
૨) એક જ રીત રિવાજ પાળતો હોય અને
૩) એકજ આચાર વિચારને વરેલો હોય.
તે પ્રમાણે આપણી કેન્દ્રીય સમાજ એક જ ધર્મ સનાતન હિન્દુ ધર્મ પાળે છે. એકજ રીતિ રિવાજ પાળે છે. અને તે એક જ આચાર વિચારને વરેલો છે. તેથી તેમાં વિધર્મીઓને સ્થાન જ હોઇ ન શકે.

૯. **સમાજના સ્થાપક ટ્રસ્ટીઓ :** આ સમાજની રચના પહેલાં આપણે સૌ જ્ઞાતિજનો ઇરાનથી આવેલા મુસ્લિમ સૈયદ ઇમામશાહ બાવા પ્રેરિત પીરાણા સતપંથ મતમાં ભટકાયેલા હતા તેથી તેઓ સૌ સતપંથી હતા. તેથી એમ કહેવું કે આ સમાજની સ્થાપના સતપંથીઓ એ કરી છે તે એક ભૂલ ભરેલી ભ્રામક વાત છે. મૂળ હકીકત તો ઉપર ફકરા ૧ અને ૨ માં આપ્યા પ્રમાણે આ સમાજની સ્થાપના એક સનાતની સમાજ તરીકેની થઇ છે તેમાં બેમત નથી.

૧૦. **બંધારણના નિયમ ૧થી ૧૭ તથા ૧૮ અને ૧૯ :** સતપંથીઓ એનું ઘટન કરે તે શું આખરી ? અરે પહેલાં વાતને સમજો અને પછી લખો તો સારું. રીતિ રિવાજોના નિયમ ૧થી ૧૭ સામાજિક છે પણ કલમ નંબર ૧૮ અને ૧૯ ધર્મને લગતી કલમો છે તેમાં ભલા માણસ કોઇજ બાંધ છોડ ન થઇ શકે. એટલે એ ફરજિયાત બને છે. સભ્યના બાહ્ય આચરણો જન્મથી મરણોતર સુધી હિન્દુના હોવા જોઇએ તે જ દર્શાવે છે કે આ સમાજ સનાતન હિન્દુ ધર્મીઓની સમાજ છે અને તેનો સભ્ય ફક્ત સનાતન હિન્દુ ધર્મ પાળતો હોવો જોઇએ અને તેથી જ આ સમાજમાં વિધર્મીઓને કોઇ દિવસ સ્થાન આપી શકાય જ નહીં.

૧૧. **મુસ્લિમ સૈયદ ઇમામ શાહ બાવા પીરાણા સતપંથ એ સનાતન હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી.** એ એક ઇસ્લામના પેટામાં આવતો શિયાધર્મનો એક ફાંટો છે. તેવી વિશ્વ માન્ય ઇન્ટરનેટ www.wikipedia.org દ્વારા વ્યાખ્યા અપાયેલ છે. હિન્દુ પ્રજાને વધારે આ બાબતે જાણવું હોય તો તે ઇન્ટરનેટની સાઇટમાં જઇને જાણી શકે છે.

૧૨. **સમાજને જોડવાનું અને તોડવાનું મિશન :** આપણી કેન્દ્રીય સમાજ એક સનાતની ઓળખ ધરાવતી સમાજ છે અને તે દરેક સનાતનીઓને જોડવાનું કામ કરે છે. સતપંથ સમાજ તો એક પ્રતિસ્પર્ધી સમાજ છે. તેના સભ્યો સતપંથ ધર્મ પાળતા હોવાથી કેન્દ્રીય સમાજને કોઇ દિવસ વફાદાર રહ્યા નથી અને ભવિષ્યમાં રહીજ નહીં શકે. હવે ઘણું થયું સતપંથીઓની શ્રદ્ધા પીરાણા સતપંથ ધર્મમાં હોય તો તેઓને નમસ્કાર છે અને તેઓ ત્યાંજ રહી તેમની શ્રદ્ધા અને વફાદારી કાયમ રાખે અને સનાતની ઓળખ ધરાવતી આ કેન્દ્રીય સમાજમાં દખલગીરી કરવાનું બંધ કરે. હવે પછી તેઓને રહેવું હોય તો સમાજના સનાતની પ્રવાહમાં ભળી જઇ સમાજે બહાર પાડેલ શ્વેતપત્રને માન આપી સમાજમાં રહેવું યોગ્ય ગણાશે.

૧૩. **કેન્દ્રીય સમાજમાં બહુમતી કે લઘુમતી એવો પ્રશ્ન જ નથી :** ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વાત પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ એક સનાતન ધર્મીઓની સમાજ છે અને તે ફક્ત અને ફક્ત સનાતન ધર્મીઓના હિતોની રક્ષા કરવા માટે જ બનાવવામાં આવેલ એક સમાજ છે. તેથી તે સમાજમાં ફક્ત સનાતન હિન્દુ ધર્મીઓજ રહી શકે અને વિધર્મીઓનું આ સમાજમાં સ્થાન ન જ હોય.

૧૪. **સ્વર્ણિમ મહોત્સવ :** સ્વર્ણિમ મહોત્સવ પહેલા કેન્દ્રીય સમાજની અસાધારણ સામાન્ય સભા તા. ૭-૫-૨૦૧૦ના દિવસે રાખવામાં આવેલ છે તેથી તા. ૭-૫-૨૦૧૦થી તા. ૧૨-૫-૨૦૧૦ દરમ્યાન દરેક સનાતની ભાઇઓ તન-મન-ધનથી ભાગ લે એવી સૌ સનાતનીઓને નમ્ર વિનંતી.

અ.ભા.ક.ક. પાટીદાર સનાતન ધર્મ જાગૃતિ સમિતિ